

મંગલસુત્ર

--સ્વ. કીશનસીંહ ચાવડા

પીતાજીના કારમા મૃત્યુ પછી બાની ઉદાસીનો પાર નહોતો. એના મુખ પર સ્મીત આવતું તે પણ વીષાદથી છવાયેલું. એના કામમાં, એના વર્તનમાં, અરે, અમારા તરફના એના વાત્સલ્યમાં પણ ઉદાસીનો આધાર હતો. મને બાનું ગળું બજુ ગમતું. એક તો આમ પણ બા બજુ દેખાવડી અને નમણી હતી. એના હદ્યની નીર્મિતાનું લાવજ્ય એના ચહેરા પર એવું વીલસંતું કે આપણે જોયા જ કરીએ. પણ એ સર્વમાં એની ડેક મને અપાર વહાલી લાગતી, અને એ ગરદનને વળગીન વહાલ કરતાં હું કદી પણ ધરાતો નહીં. નીશળમાં કંઈક ગુનો થયો હોય, કોઈ સાથે તકરાર થઈ હોય ત્યારે હંમેશાં હું એની ડેક બાજી પડતો. મંગલસુત્રથી શોભતા એ ગળાને બચ્ચીઓ ભરતાં હું કદી જ થાકતો નહીં અને એના બદલામાં હું ધરાઈને એનું વાત્સલ્ય પીતો.

બાપુજીના ગયા પછી બાનો ઉદાસ ચહેરો મંગલસુત્ર વીનાના સુના ગળાથી બજુ એકલો લાગતો. બા પણ ઇત્તે વીનાની અનાથ લાગતી. મારી દાખી જ્યારે જ્યારે બાના ચહેરા પર પડતી ત્યારે આપમેને એની એકલ ડેક પર ઉત્તરીને હુસ્કું ભરી લેતી. આ હુખ ખમનાર હું એકલો નહોતો. મારાં પાર્વતીશૈરી પણ હતાં. ફેઠ પોતે બજુ રૂપાળાં હતાં. પણ બાના સ્વરૂપનાં એ મોટાં ચાહક હતાં. મને બરાબર યાદ છે. એક દીવસ ફેરી, બા અને હું એમ ત્રણ જણાં બેઠાં હતાં. પીતાજીનાં સ્મરણોની ઉજાણી ચાલતી હતી. ત્યાં અચાનક ફેરીની આંખ બાના ગળા પર જઈને બેઠી. એમનાથી રહેવાયું નહીં. બોલ્યાં : ‘ભાની, ગળામાં તુલસીની માળા તો રાખ જ. આ સુની ડેક મારાથી જોવાતી નથી.’ અને સ્વાભાવિક રીતે જ એમનો હાથ બાના ગળાને અહકી પડ્યો. બાએ માથે એવી રીતે ઓફન્યું કે ડેકની ચારુતા સંતાઈ ગઈ. બા કશું બોલી નહીં. બા ગમતી. બાનું સ્વરૂપ ગમતું. બાની આંખોમાં આંખ પરોવતાં હું થાકતો નહીં. પરંતુ બાની ડેકને બાથ ભરી બચ્ચી ભરવી એ મારાં જીવનનું પરમ ઐશ્વર્ય હતું. ઇતાં એ એકલવાઈ ડેક જ મને રહાવી મુકતી અને બાના ગયેલા સૌભાગ્યની યાદ આપીને પીતાજીનાં સ્મરણોની યાત્રા કરાવતી.

ધનતેરસે અમારે ત્યાં ધનની પુજા થતી. પીતાજી જીવતા ત્યારે પણ બા મારી પાસે જ પુજા કરાવતી. બાપુજીના ગયા પછી પણ એમ જ થતું. પણ બાપુજીના ગયા પછી ધનતેરસની પુજામાં એક ફેરફાર છાનો ન રહ્યો. હું પુજા કરી રહું ત્યાર પછી એક નાની શીરેશમી પોટલીમાંથી પોતાનું મંગલસુત્ર કાઢીને બા દુધથી અને પછી પાણીથી ધોઈ એની પુજા કરતી અને પાછી એ પોટલીમાં સંભાળથી એને મુકીને ચાંદીની એક હબ્બીમાં મુકી દેતી. આવી ધનતેરસ દરેક વરસે આવતી અને ચાલી જતી. ધીરે ધીરે પેલું મંગલસુત્ર મારે મન બા જેટલું જ વહાલું થઈ ગયું.

ઇ.સ.૧૮૮૮માં હું પોંડીચેરીથી પાછો આવ્યો ત્યારે મારું મોટું સુખ બાનો હસતો ચહેરો હતો. હું ગયો ત્યારે એને જે ઓછું આંખું હતું તે હું પાછી આવ્યો ત્યારે હસીને એણે ઓગળી નાંખ્યું. અહીં સૌ સુખી હતાં. આવીને મેં ‘નવગુજરાત’ સાપ્તાહીકમાં સહતંત્રીનું કામ સ્વીકાર્યું. બાને બજુ જ આનંદ થયો. એ કારણે મારે સવારે, બપોરે, સાંજે એમ ગમે ત્યારે ગમે તેટલું રખજવું પડતું. એક વખત ઊનાળો હતો. વૈશાખનો મહીનો. ગરમી તો કહે મારું કામ. લુ એવી વાય કે માથું ઝાંચી જાય. એવા સણગતા બાપોરે બે વાગે ભુખ્યોતરસ્યો હું ઘરે પહોંચ્યો. બા પણ બીચારી ભુખીતરસી મારી વાટ જોઈને મારી ચીંતા કરતી બેઠી હતી. હું આવ્યો ત્યારે એનો ચહેરો કરમાઈ ગયો હતો. અમે જાયાં. જમીને હું જરા જાયાં. ઉઠ્યો ત્યારે મારું આંખું શરીર તાવથી ધીખતું હતું. બા તો ગભરાઈ ઉઠી. ધરના બધા ઈલાજે એણે કર્યી. પણ તાવે મચક ન આપી. આખરે દાક્તરને બોલાવવા પડ્યા. દાક્તરની સલાહથી મને ઈસ્પીતાલ ખસેહયો અને આખરે ઈશ્વરની કૃપાથી અને બાની આશીષથી બે મહીને સારો થઈ ગયો.

ત્યારપછીની ધનતેરસે અમે પુજા કરવા બેઠાં. પુજામાં માત્ર પાંચ રૂપીયા હતા. એક પણ ઘરેણું નહોતું. મને અચંબો લાગ્યો. ધનની પુજા પછી બાએ નીત્ય નીયમ પ્રમાણે પોતાના મંગલસુત્રની પણ પુજા કરી. પછી મેં બાને પુછ્યું ત્યારે ખબર પડી કે મારા પોંડીચેરીના લાંબા નીવાસ દરમીયાન બાએ ઘરેણાં વેચીને ઘર ચલાયું હતું. તે દીવસે હું બાની એ એકલવાઈ ડેક બાજીને ખુબ રજ્યો.

શીયાળો ગયો ને ઉનાળો આવ્યો. મારી ખુબ ઈચ્છા હતી કે હું એક સાઈકલ લઈ. પણ એટલી બચત કર્યાંથી કાઢવી? એક રાતે બેસીને અમે સૌ વાતો કરતાં હતાં. ત્યાં મારાથી સાઈકલની વાત નીકળી ગઈ. સાઈકલ વીના કેટલી મુસીબત પડે છે એ સાંભળી બાનું હૈયું ભરાઈ આવ્યું. બીજે દીવસે બપોરે મને પાછું મોટું થયું. બા બીચારી દર વખતની

જેમ ભુખીતરસી મારી રાહ જોઈને બેઠી હતી. મને જમાજ્યા પછી પણ એની એક જ ચીંતા હતી કે હું માંદો ન પડું. બપોરે જમીને હું કામ પર જવા નીકળ્યો ત્યારે બાઅએ પુછ્યું : ‘બેટા, સાઈકલ હોય તો તને મહેનત ઓછી પડે, નહીં?’ મેં જતાં જતાં હસીને કહ્યું : ‘બા, એ તો કબીરજી કહી ગયા છે.’ જ્યારે જ્યારે મારે બાને હસાવવી હોય ત્યારે હું ઉપરનું વાક્ય વાપરતો.

સાંજે હું ઘેર આવ્યો ત્યારે ઓટલા ઉપર એક નવી સાઈકલ પડેલી. મને એમ કે ક્રોઝ મળવા આવ્યું છે. મારો અવાજ સાંભળીને બા બહાર ઢોડી આવી. એના મુખ પર અવર્ગનીય આનંદ હતો. ઘણાં વરસ પછી મેં એનો આવો પ્રકુલ્પિત ચહેરો જોયો. એમણે કહ્યું : ‘કીશન, તારી સાઈકલ આવી ગઈ.’ આનંદ અને આશ્ર્યની મીશ્ર લાગણીથી દબાઈ ગયેલો હું પુછ્યા જાઉં તે પહેલાં તો હાસ્યનું ઠિનામ આપીને બા બોલી ઉઠી : ‘હું લઈ આવી, ગોપાળદાસકાકાને ત્યાંથી. ગમીને?’ એમણે કહ્યું : ‘હમણાં છોકરાઓ આ ગાડી બહુ શોખથી વાપરે છે. સારી છે ને?’ મેં કહ્યું : ‘પણ બા, હમણાં મારે નહોતી જોઈતી.’ અને હું આગળ બોલવા જાઉં તે પહેલાં તો એ બોલી ઉઠી : ‘ફરવી જો તો. હું જોઉં તો ખરી કે તને કેવીક ચલાવતાં આવડે છે.’ અને મેં એ નવી સાઈકલ પર ચક્કર માર્યું ત્યારે એમ બંને ખુશ ખુશ થઈ ગયાં.

ત્યાર પછીની ધનતેરસે એમે પુજા કરવા બેઠાં હતાં. બાએ મારી પાસે પાંચ રૂપીયાની પુજા કરાવી અને પુજા પુરી થઈ. બાએ મંગલસુત્રની પુજા ન કરી એટલે મેં પુછ્યું : ‘બા, તમારી પુજા કેમ નથી કરતાં?’ બાએ હસીને કહ્યું : ‘હવે જરૂર નથી. તું સાઈકલ પર બેસીશ અને હું તને જોઈશ એ જ મારી પુજા છે.’ મારા અંતરમાં ક્ષણ પડી. મેં કહ્યું : ‘બા, તમે મંગલસુત્ર વેચીને આ સાઈકલ લઈ આવ્યાં?’ અને મારાં ઉત્તરેલાં મુખને બાએ પોતાની ડેક પર ઢાળી દીધું. મારાથી ન તો બાથ ભરાઈ, ન તો બરચી કરી શકાઈ.

બીજે દીવસે હું એક મીત્ર પાસેથી એકસો દસ રૂપીયા લઈને ગોપાળદાસકાકાને ઘેર ગયો. કાકા તો ઘેર નહોતા. પણ ગુલાબકાકી હતાં. એ બહાર આવ્યાં ને મેં એમની ડેકમાં બાનું મંગલસુત્ર જોયું. રૂપીયા મારાં ગજવામાં રહી ગયા. કાકાની ખબર પુછીને હું ચાલી નીકળ્યો. પાછા આવીને મેં બાને કહ્યું : ‘ગુલાબકાકીના ગળામાં તમારું મંગલસુત્ર જોઈને મારાથી એક શબ્દ બોલાયો નહીં.’ બાએ હસીને કહ્યું : ‘બેટા, એમનું સૌભાગ્ય અંદર રહો.’ બાનું એ મુખ આજેય જ્યારે જ્યારે હું મારી સાઈકલને અહુકુ દ્યું ત્યારે મારી આંખો આગળ આવે છે અને અંતરને અહુકે છે. સાઈકલો તો મારી ઘણી બદલાઈ છે; પણ બાનો એ ચહેરો નથી બદલાયો.

-કીશનસીહ ચાવડા

‘સન્દેહ-મહેશીલ’ – વર્ષ : ત્રીજું – અંક : 131 — December 9, 2007
 ‘ઉજાજોહણી’માં અને ‘વીજ્યા’ ફેન્ટમાં સાભાર અક્ષરાંકન : વીજેશ શુક્ર -vijvan302@gmail.com



કીશનસીહ

સને ૧૯૦૪માં વડોદરામાં જન્મેલા સર્જક સ્વ. કીશનસીહ ચાવડા મર્મગાહી પ્રસંગોના આલેખક અને જીવનમાંગયનું દર્શન કરાવનારા ગુજરાતી સાહીત્યના અમર સર્જક. તેઓ ‘જીપ્સી’ના ઉપનામે લખતા. એવી જ ભાતીગળ એમની છંદગી પણ હતી. માનવજીવનના વાસ્તવીક અને બહુરંગી જીવનપ્રસંગોને એમણે એમના ‘અમાસના તારા’ પુસ્તકમાં આલેખ્યા છે. આ એક જ પુસ્તકના વાચનથી વાચક, સર્જકની ઉચ્ચી કલાસુઝ, એમનો ભાષાવૈભવ, એમના નીર્મળ હંદયની પારદર્શિતા અને જીવન પત્યેના એમના એક સાધકક્ષાના અભીભુતી

થઈ ઉઠે. ‘શર્વરી’ નામનો એનો એક વીશીષ વાર્તા-સંગ્રહ, ‘સમયના દ્વીપ’ નામનો નીબંધસંગ્રહ, ‘અમાસથી પુનમ ભષ્ણી’ નામક એમની આધ્યાત્મિક વીકાસની આત્મકથા, ‘હીમાલયની પત્રયાત્રા’ નામક પ્રવાસ-પુસ્તક એમનાં ગણનાપાત્ર અને યાદગાર પુસ્તકો છે. કીશનસીંહ મહાત્મા ગાંધીની વીઘાપિઠ, ગુરુદેવની શાંતિનીકેતન અને શ્રી. અરવીંદના પોંડીચરી આશ્રમનું સંતાન ગજાતા. પુષ્કળ પ્રવાસ, વીવીધક્ષેત્રની વીશીષ પ્રતીભાઓનો બહોળો સંપર્ક-અનુભવ અને તેનું રોચક આલેખન રસાળ શૈલીમાં તેમજો આપ્યું.

આજાદીના સંગ્રહ વેળા તેઓ વીર ભગતસીંહના સાથીદાર બન્યા. ગાંધીજી સાથે ભગતસીંહની મુલાકાત ગોઠવી આપનાર આ મુલાયમદીલ સર્જકથી, ‘અત્યા કીશન, તું પણ હોસાને માર્જો?’ એવી ગાંધીજીની ટકેર સહન ન થઈ અને તેઓ સાધનાને પંથે વળી શ્રીઅરવીંદ આશ્રમે સીધાત્યા. પણ ત્યાંયે તેમને ન ગોઠયું.

એમના પ્રીય વીષય ‘પ્રી-ટીંગ પ્લાંટ મેનેજમેન્ટ’ના વીશીષ અભ્યાસ માટે તેઓ ૧૮૪૮માં અમેરીકા ગયા. પછી વડોદરામાં ‘સાધના’ અને ‘ચેતના’ પ્રેસનું સંચાલન તેઓ કરતા. ‘કાત્રીય’ અને ‘નવગુજરાત’ નામક રાષ્ટ્રીય સાપ્તાહીકીનું સંપાદન એમજો કરેલું. શ્રી. કીશનસીંહ ચાવડાએ અત્ય પણ અનન્ય સાહીત્ય આપી ગુજરાતીને ગૌરવાન્વીત અને માત્ભર કરી છે.

તા. ૨ ડીસેમ્બર ૧૮૭૮ના દીને વડોદરાના ટાઉન હોલમાં ‘સરદાર વ્યાખ્યાનમાળા’માં, સરદાર સાહેબ સાથેના પોતાનાં મધુર સ્મરજો વાગ્ફોળતાં વાગ્ફોળતાં ભાવવીભોર અવસ્થામાં જ આ સર્જકે માશું ઢાળી દીધું...

–ઉત્તમ ગજીજર અને બળવંત પટેલ

સર્જકનું રેખાંકન સાભાર : શ્રી સવજી છાયા-(દ્વારકા) તથા સર્જકના પરીચયમાં ખુટ્ટી બે કડી સુલભ કરાવી આપનાર સુરતના મીત્ર ભાઈ **શ્રી. રમેશ શાહ ramesh_pathshala@yahoo.com** નો ખુબ આભાર..**ઉત્તમ ગજીજર**



શુક્રવાર ૧૩મી જાન્યુઆરી ૨૦૦૬ના દીને મુંબઈ ખાતે લોક્સીકોનના થયેલા પ્રથમ લોકાર્પણ પછી

5,72,000 જેટલા ભાષાપ્રેમીઓએ અત્યાર સુધીમાં <http://www.gujaratilexicon.com>

લોક્સીકોનની મુલાકાત લીધી. આપને અને આપ મારફત આપના મીત્રોને પણ લોક્સીકોનની આ નવી interfaceની મુલાકાત લેવાનું નીમંત્રણ છે. વીશ્વનાં કરોડો ગુજરાતી ભાઈ-બહેનો સુધી આ સંદેશો પહોંચાડવામાં સહાય કરી, આપને પણ ગુજરાતી ભાષાની અમૃત્ય સેવાના પુષ્ટના અધીકારી બનવા વીનંતી.

આપ સૌના સહયોગ થકી **સંકે ઈ-મહેફીલના 7,500 જેટલા વાચકો થયા અને રોજેરોજ નવાં નામો ઉમેરાતાં જાય છે એ પુરવાર કરે છે કે, દેશવીદેશમાં ગુજરાતી વાચનના રસીયા બહુ મોટી સંખ્યામાં છે.**

સૌનો આભાર..અમારી સંકે ઈ-મહેફીલની અત્યાર સુધીની જુની સંઘરી પીડીએફ ફાઈલો

અમારી વેબસાઇટ <http://gujaratilexicon.com/index.php?action=downloadSeM>

પરથી સરળતાથી ડાઉનલોડ થઈ શક્શે. આ જ વેબ સાઇટ પરથી લોક્સીકોન અને **શ્રી વીપુલ કલ્યાણી** તરફથી લંડનથી પ્રકાશીત થતા ‘ઓપીનીયન’ માસીકના કેટલાક નમુનાના અંકોની અને **શ્રી. પ્રવીણ વાધાણી** (મેલ્બોર્ન-ઓસ્ટ્રેલીયા) તરફથી પ્રકાશીત થતા ‘માનુભાષા’ માસીકની મુલાકાતે પણ જઈ

શકશે..



● મધુરેશ સમાપયેતુ ●



તમારી વાત સાચી છે... હાઉસવોમ્બાગ પાર્ટી તો ઘરમાંજ શોલે...; પણ ઘરે પાર્ટી રાખીએ તો આવડા મોટા જમેલામાં મીલીયન ડોલરના ઘરની તો વગર જોઈતી પતર જ રગડાઈ જાય ને? એટલે બહુ વીચારીને અહીં ટેમ્પલના હોલમાં જ પાર્ટી રાખી છે. અહીં તો કંઈ ભાંગ્યું, તુટ્યું, બગડ્યું, ફલ્યું, પલ્યું એની કશી ચીતા તો નહીં !

પે-સીલ્વેનીયા-અમેરિકામાં વસેલા અમદાવાદી કાર્ટુનિસ્ટ શ્રી. મહેન્દ્રભાઈ શાહનો

ઈ-મેઇલ સંપર્ક : mahendraaruna@msn.com

એમનો પરીચય પામવા અને એમનાં ખુબ બધાં કાર્ટુન્સ માણવા જુઓ એમની

web site : www.ameamericanamdadavadi.com

‘સન્દેશ-મહેશીલ’ -- વર્ષ: ત્રીજું -- અંક: 131 -- December 9, 2007
 ‘ઉત્તીજેન્દ્રશી’માં અને ‘વીજયા’ ફેન્ટમાં સાભાર અક્ષરાંકન: વીજેશ શુક્રવાર vijvan302@gmail.com

